

Be the BEST


BAPS Presentation

Day-13 | 29 June, 2020



પ્રયોજક : બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, અમદાવાદ.

“Satsang”



“સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ;
સંત કૃપાથી પામીએ, પૂરણ પુરુષોત્તમ ધામ.”

જાળમિત્રો, પણ સંતકૃપા થાય ક્યારે?
સંતનો સંગ કરીએ ત્યારે...
આવો નિહાળીએ વીડિયો દ્વારા...




Click here

“Study Technique”

“જો પાકકા ના કર્યા ઘડિયા (Table),
તો ગણિતમાં પાછા પડ્યા.”

જાળમિત્રો, આજે આપણે ઘડિયા (Table)
તૈયાર કરવાની એક સરળ રીત શીખીશું.
લીંક દબાવો અને રીત શીખો...



Click here

Be The Best

“Skill”



“ભણવાની લાગે મને ભૂખ,
જો હોય ટીનીમીની નોટબુક.”

તો થઈ જાવ તૈયાર...

લીંક દબાવો અને ટીનીમીની
નોટબુક બનાવતા શીખો.



Click here

“Fun Time”

“ટીપે ટીપે સરોવર ભરાય,
કાંકરે કાંકરે પાળ બંધાય;
આડા-અવળા ટુકડાથી પઝલ રચાય,
એ પઝલ સૌને શીખ આપી જાય.”
લીંક દબાવો અને પઝલ ઉકેલો...



Click here

Be The Best

“My Guru, My Life”

બાળમિત્રો, આપણે પ્રાર્થના કરીએ છીએ
તે સ્વામીબાપા સુધી પહોંચે જ છે, સ્વામીબાપા તે સાંભળે જ છે.
પણ આપણે પ્રાર્થનામાં શું માંગીએ છીએ???

તમારાં જેવા જ એક બાળકે મહંતસ્વામી મહારાજને
તેની કાલીઘેલી ભાષામાં ખૂબ અદ્ભુત પ્રાર્થના કરી છે...!

ચાલો, તે સાંભળીએ.
લીંક દબાવો અને વિડીયો માણો...

 [Click here](#)



Be The Best

“General knowledge”



બાળમિત્રો,
આજે આપણે ભવ્ય ભારતના
ઇતિહાસ વિશે થોડું જાણીશું.
લીંક દબાવો અને
વિડીયો માણો.

 [Click here](#)

“Your Opinion”

છેલ્લા ઘણા દિવસથી આપણે સૌ
‘Be the Best’ માણીએ છીએ.
બાળમિત્રો, આજે આપને
અમૂક પ્રશ્નો પૂછવામાં આવશે,
જેના જવાબ આપે આપવાના છે.
લીંક દબાવો અને પ્રશ્નો વાંચી જવાબ આપો...

 [Click here](#)



Be The Best

"Memories"



bhakti patel, Bhuj




Bhakti Darji
Ahmedabad



Face Shield

Divyesh Vaghela



Jayesh & Upasana
Dar es salaam



Friends, આપને ખૂબ જ આનંદ થશે કે...

"Be the Best" ની બધી activity દેશ-વિદેશમાં
રહેતા આપણા બાળમિત્રો ખૂબ જ સારી રીતે કરી રહ્યાં છે...
તો આવો... તે સૌ બાળમિત્રોએ અને તમે મોકલેલાં
ફોટોગ્રાફ્સને જોઈએ અને આનંદ કરીએ...
નીચેની લીંક દબાવવાથી આપ તે બધા જ ફોટોગ્રાફ્સ જોઈ શકશો.



Click here

Be The Best

આપનો ડૉક્ટર મિત્ર



દર ૨૦ મિનિટે
સાબુથી ઘસીને હાથ
ઘોઈ નાંખશો.



ઉધરસ/છીંક
આવે તો રૂમાલ
રાખીને ખાશો.



બહાર જાવ
ત્યારે માસ્ક
હંમેશા પહેરશો.




ઘરની બહાર
નીકળવું નહિ.



આંખ, મોઢું, નાકને
સ્પર્શ કરવાનું ટાળો.



ઘરમાં એકબીજા
સભ્યોથી દૂર રહો.

નોંધ : બાળમિત્રો, આપના દ્વારા થતી પ્રવૃત્તિના સુંદર ફોટોગ્રાફ્સ રોજ અમને પ્રાપ્ત થાય છે. જ્યારે આપ ફોટા મોકલો ત્યારે **નીચેની લીંક** પર જે રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે જ રીતે ફોટા મોકલશો. ફોટાની અંદર જ **તમારે તમારું નામ અને શહેરનું નામ** લખીને મોકલવાનું રહેશે. જે તે પ્રમાણેનો ફોટો નહીં હોય તો અહીં **મૂકવામાં આવશે નહીં**. તેની અવશ્ય નોંધ લેશો. ( 9998999209)

 [Click here](#)

વિશેષ નોંધ : ૧. એક્ટિવિટી ઈઠ એક જ ફોટોગ્રાફ મોકલવો.

૨. આજની એક્ટિવિટી સિવાયની અન્ય બીજી કોઈ એક્ટિવિટી કે પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ મોકલીશું નહીં.

જય સ્વામિનારાયણ

<http://kids.baps.org> | <https://www.baps.org>



પ્રયોજક : બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, અમદાવાદ.

પ્રેરક : પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ

Be The Best